

23 મે 2018

“આ છે બ્રેમ્પટન (This Is Brampton)” પ્રસ્તૂતિ: જૂન 15

GTANA નોર્થવેસ્ટનું સંગીત, ફિલ્મો અને સંસ્કૃતિ NXNE ખાતે ભેગા થશે

બ્રેમ્પટન, ઓન્ટારિયો – જૂન 15ના રોજ, બ્રેમ્પટનને પોતાનું વતન માનતા હોય એવા એકદમ જોરદાર નવોદિત કલાકારોની પ્રસ્તૂતિ ટોરોન્ટો ખાતેની રિવોલીમાં જે એક આઈકોનિક લાઈવ મ્યુઝિકનું વેન્યુ ગણાય છે તે બ્રેમ્પટનમય થઈ જશે. આ ક્યારેય ન થઈ હોય એવી પ્રથમ વખત થનારી વિશ્વના અગ્રેસર ગણાતા મ્યુઝિક ફેસ્ટિવલ નોર્થ બાય નોર્થઈસ્ટ (North by Northeast) (NXNE) સાથેની ભાગીદારી છે જે તેઓના ટેસ્ટમેકર્સ ક્લબ લેન્ડ સિરિઝ (Tastemakers Club Land Series)નો ભાગ હશે. શહેરમાં સંગીતના ક્ષેત્રની સમૃદ્ધિનો આ રોમાંચક પુરાવો છે.



જેનું હોસ્ટિંગ મલ્ટિ-પ્લેટિનમ મ્યુઝિક નિર્માતા ઈસ્ટબાઉન્ડ (EastBound) દ્વારા થયું છે, જેમણે ટ્રેવિસ સ્કોટ (Travis Scott), યંગ થગ (Young Thug) અને બીજા ઘણા બધાં સાથે ટ્રેક્સનું નિર્માણ કર્યું છે, આ લાઈનઅપનું વ્યવસ્થાપન નોયઝ (Noyz) (રેકોર્ડિંગ આર્ટિસ્ટ), ડેનિઝ જોન્સ (Denise

Jones) (એક્સકો લેવિ [Exco Levi] માટે આર્ટિસ્ટ મેનેજમેન્ટ) અને એરિન એશ્લિ (Erin Ashley) (હિપ હોપ સંપાદક, NOW મેગેઝિન) ની મદદથી થયું છે જેથી બ્રેમ્પટનના સૌથી રોમાંચક વ્યવસાયિક કલાકાર બનવાની તૈયારીમાં હોય એવી નવોદિત પ્રતિભાઓનું પ્રતિનિધિત્વ થઈ શકે.

થિસ ઈઝ બ્રેમ્પટન શોકેસમાં ભાગ લેશે:

- વાઝ (Vaz) @vazmusic
- સેલેના ધિલ્લોન (Selena Dhillon) @selenadhillon
- ફાબ (Phab) @1phab
- એવરિથિંગઓશોન (EverythingOShaun) @EverythingOShaun

આ પ્રસંગ અને ઉચ્ચ અપેક્ષાઓ રાખવામાં આવે છે એવા "સૂપરફ્લાય (Superfly)"નું વર્લ્ડ પ્રિમિઅર પણ એક જ સમયે થશે – જે 1972ના ક્લાસિકની રિમેક છે, જે બ્રેમ્પટનના પોતિકા કહી શકાય એવા આર્ટ્સ વોક ઓફ ફ્રેમના સૌથી નવીન પ્રવેશ કરનાર, ડિરેક્ટર X દ્વારા થયેલ પુનઃ સર્જન છે. ડિરેક્ટર Xની સફળતાને વધાવવા માટે થિસ ઈઝ બ્રેમ્પટન શોકેસ દરમિયાન રૅપર ફ્યુચર (Future) દ્વારા નિર્મિત "વોક ઓન મિંક્સ" અને "નો શેમ"નો સમાવેશ કરતા સાઉન્ડટ્રેકના ન્યુ મ્યુઝિકને પણ વગાડવામાં આવશે.

ક્યારે શુક્રવાર, જૂન 15, 2018

સમય: દુવાર ખુલશે સાંજે 9 વાગ્યે

ક્યાં: રિવોલિ, 334 કિવન સ્ટ્રીટ વેસ્ટ, ટોરોન્ટો

ટિકિટ: થિસ ઈઝ બ્રમ્પટન શોકેસની ટિકિટો અને રિસ્ટ્રેન્ડ્સની કિંમત છે \$29. અહીં ઉપલબ્ધ છે nxne.com.

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.